

## નંદન મહિયાર

રાજગૃહી નગરીમાં નંદન મહિયાર નામનો એક ધનાદ્ય ગૃહસ્થ રહેતો હતો. એક વખત લગવાન શ્રી મહાવીરહેવ શાહેર બહાર ઉધાનમાં પદ્ધાર્યો હતા. ધર્મશ્રવણ અને વંદન કરવા નિમિત્તે ત્યાંને ઓળિણુકુ રાજ તથા ષીજ શ્રદ્ધાળુ લોકો ત્યાં આવ્યા. તે વખતમાં એક દુર્દુરાંક નામનો હેવ સલામાં આવ્યો. તેણે વિવિધ પ્રકારે હેવકુમાર અને હેવકુમારીએને પોતાની શક્તિથી પ્રગટ કરી, નૃત્ય-ગાયન કરી, પોતાની હેવશક્તિ સર્વ સલાને ભતાવી. આ શક્તિ ભતાવવાનો હેતુ કાંઈ પોતાની શક્તિ કે ઋદ્ધિનું અલિમાન ન હતું પણ ધર્મના ઇળમાં સંહેઠ કરનારા જીવેને દફ કરવા નિમિત્તે અને જીવો પોતાના આત્મબળથી અનંત શક્તિએ મેળવી શકે છે તે જણાવી ધર્મકાર્યમાં ઉત્સાહિત કરવા નિમિત્તે તથા જે મહાપુરુષના બોધથી પોતે આ શક્તિને પામ્યો હતો તેની કાંઈ પણ લક્ષ્ય કરવી-આ નિમિત્તે તેનો પ્રયાસ હતો.

દુર્દુરાંક હેવ આ પ્રમાણે લગવાન શ્રી મહાવીર-હેવની લક્ષ્ય, સ્તુતિ, વંદન, નમન કરીને તથા લગવાનના શરીરે ઉત્તમ સુગંધી દ્રોવ્યો-ચંદ્ન આદિનું વિક્રેપન કરીને, તે દ્રોવ્યો સલાને પોતાની શક્તિથી વિદ્ધા ને પરુ જેવા હેખાડી સ્વસ્થાનકે ગયો. ત્યારે જણાવા છતાં પણ સલાના બોકેને ધર્મમાં સ્થિર કરવા નિમિત્તે શ્રી ગૌતમસ્વામીએ લગવાન શ્રી મહાવીરહેવને પૂછ્યું હૈ-‘હે પ્રભુ! આ હેવ આટલી બધી ઋદ્ધિ અને શક્તિ કૃયા શુલ કર્તાવ્યથી

મેળવી ? વાત ખરી છે કે-શુલ કર્તવ્યથી નાના પ્રકારની ઋદ્ધિસિદ્ધિ મળે છે. જીવેનું મૂળ લક્ષ્ય તો આત્મવિશુદ્ધિ ઉપર જ હોય છે, પરંતુ જેમ અનાજ નિમિત્તે અનાજ વાવવા છતાં ધાસ, કડાચ વિગેરે સ્વાભાવિક અનિચ્છાએ પણ થાય છે, તેમ આત્મવિશુદ્ધિ કરવાના પ્રયત્નમાં પુન્યકર્મ સ્વાભાવિક થાય છે અને તેને લઈને બધી અનુકૂળ સામગ્રીએ મળી આવે છે; છતાં મૂળ ઉદેશ તો વિશુદ્ધતાનો હોવો જોઈએ. ’

ભગવાન શ્રી મહાવીરહેવે જ્વાખ આપ્યો કે-‘હે ગૌતમ ! આ હેવનો જીવ રાજગૃહી નગરીમાં નંદન મણિયાર નામે એક ધનાઢ્ય ગૃહસ્થ હતો. એક દિવસ હું અહીં આપ્યો હતો. ત્યારે મારો ઉપદેશ સાંભળી તે સમ્યગ્રૂહિત પામ્યો હતો. વળી તેણે ગૃહસ્થને લાયક પ્રતિ-નિયમો મારી પાસે પ્રહંષુ કર્યાં હતાં. કેટલાક વખત સુધી તેણે આ ગૃહસ્થધર્મ સારી રીતિએ પાળ્યો, પણ પાછળથી કુદૃષ્ટિ-ઉન્માર્ગામન કરનાર પાંચ ઈદ્રિયોના વિષયોમાં આસક્તિવાળા મનુષ્યોનો સંસર્ગ તેને વધારે થવા લાગ્યો. અને તેને તેની સમ્યગ્રૂહિતને પોખરું આપનાર, વૃદ્ધિ પમાડનાર તથા શુદ્ધ માર્ગમાં ટકાવી રાખનાર સાધુઓની-આત્મનિષ્ઠ ગુરુઓની સોભત પીલકુલ રહી નહિ. સાધુપુરુષોની સોભતના અભાવે તેનામાં ભિથ્યાભુદ્ધિનો વધારો થતો રહ્યો અને સદ્ગુર્દ્ધિ-સમ્યગ્રૂહિત ધીમે ધીમે મંહ મંહ લાવને પામવા લાગી. કંઈક મિશ્ર-પરિણામે તે કાળજીપ કરવા લાગ્યો.

એક વખત ઉનાળાના દિવસોમાં તે ગ્રણુ ઉપવાસપૂર્વીક પૌષ્ઠ લઈને ધર્મકિયા કરતો હતો. ઉપ-સમીપે-વસન-

વાસ=આત્માની સમીપે રહેવું તે ઉપવાસ. ઉપવાસનો અરો આંતરૂગલીંત અર્થું આત્માની સમીપે રહેવું તે થાય છે અને પૌષ્ઠનો અર્થું આત્માને પોષણું તથા પુષ્ટિ આપનાર આત્માની વિશુદ્ધિ કરનાર થાય છે.

અનાજનો તથા પાણીનો ત્યાગ કરી ભૂખ્યા રહેવું તેટલો સાંકડો ઉપવાસનો અર્થ નથી. તે અર્થ તો ઉપવાસનું બાધ્ય રૂપક છે. વ્યવહારિક અર્થ એવો થાય છે અરો, પણ તેનાં આંતરૂળવન સિવાય આ વ્યવહારિક અર્થ ઉપયોગી થતો નથી. સમ્યગ્રૂપ્દ્ધિ જીવમાં તે ઉપવાસનું આંતરૂળવન હોય છે. આ આંતરૂળવનના અલાવે, બાધ્ય સ્વરૂપવાળો ઉપવાસનો અર્થ ચોઆઓ કાઢી લીધા પણી બાકી રહેલા ફેતરા જેવો છે. આત્માની સમીપે રહેવું તે ચોઆઓ જેવું છે, ત્યારે આબું નહીં તે ઉપવાસનો અર્થ ઉપરના ફેતરા જેવો છે. આ ફેતરાં ઉપયોગી છે, ચોઆબાનું રક્ષણું કરનાર છે, ઉપધંસક છે, પણ ચોઆઓ વિનાના એકલા ફેતરાં ઉપયોગી નથી, તેની કિંમત નથી. આત્માની સમીપે નિવાસ કરવારૂપ આંતરૂળવન સિવાય આ એકલા ઉપવાસને લાંઘણું કહેવામાં આવે છે.

આ શરીર એક રાઙડા જેવું છે, ત્યારે કામ, કોધ, રાગ, દ્રેષ, ધર્ષા, અલિમાન ધર્યાદિ સર્વ સમાન છે. મારવો છે સર્વ અને તોડવો છે રાઙડાને, તેથી શું કાયદો થાય? જેમ રાઙડાને તાડના કરાય છે, તેમ અંહરનો સર્વ ઊડા પેસતો જય છે. અરી રીતે કામ-કોધાદિને હઠાવવાના છે. આત્મજ્ઞાનના પ્રકાશથી તે હઠી શકે છે. તેને ભૂલી જઈ

એકલા શરીરને શોષી નાભવાથી ઉદ્દું સાધન નથળું પડી જાય છે. સાધનને નથળું પાડી નાંખવાથી કાંઈ અજ્ઞાન હડી શકતું નથી.

આ નાંહન મણિયાર અટૂઠમ-ત્રણ ઉપવાસ કરી શરીરને નથળું પાડતો હતો, પણ તેના કામ-કોધાહિ નથળા પડતા ન હતા; કારણું કે-તેનામાંથી સમ્યગ્નાદ્વિષ્ટ ચાલી ગઈ હતી અને મિથ્યાદ્વિષ્ટ આવી એડી હતી. સમ્યગ્નાદ્વિષ્ટ તે આંતર્જીવનનો ગર્ભ છે. તે ચોખા સમાન છે. તેના અલાવે આ ઉપવાસ કરવારૂપ ફોટરાં શું ઉપયોગી થાય ? આમ ઉપવાસથી નથળું પડેલું શરીર બીજે દિવસે લોજન કરવાથી પાછું હતું તેવી સ્થિતિમાં આવી જવાનું. એકાદ મહિના સુધીના ઉપવાસ કરાયેલા મતુષ્યનું શરીર એકાદ-એ માસ પછી પાછું પૂર્વની સ્થિતિમાં આવી જાય છે, ત્યારે તેના કોધાહિ કથાચેલા તો ઉપવાસના દિવસોમાં પણ પ્રસંગે અધિક હીંપી નીકળે છે. આથી આ ઉપવાસોથી-એકલા ઉપવાસોથી-આત્માની પાસે રહેવા સિવાયના ઉપવાસોથી વસ્તુતઃ ફાયદો માલુમ પડતો નથી.

ભાઈ ઉપવાસો આંતર્પ્રવૃત્તિમાં આવતાં વિધો-અડચણો ફૂર કરવા માટે છે અને ખાવાપીવાનો વખત ખચાવવા માટે છે. ખાવાને લીધે બહાર જંગલપાણી જવાનું થાય છે, આળસ આવે છે, જિંધ વધે છે અને બ્યવહારના કામમાં પ્રવૃત્તિ વધે છે. આ સર્વ અટકાવવાનો ઉદેશ ભાઈ ઉપવાસનો છે.

ઉપવાસને દિવસે આરંભ એછો કરાય છે. ઉપવાસના કારણે પ્રવૃત્તિ-બ્યવહારની ભાઈ પ્રવૃત્તિ એછી કરાય છે. વિષયની દિચ્છાએ ઉપર કાણું મેળવાય છે અને આળસ, જિંધ, જંગલપાણી અને ખાવાપીવાનો ત્યાગ દિત્યાહિ કારણે લઈ

અચેતા વખતનો ધર્મધ્યાનમાં ઉપયોગ લેવામાં આવે છે.

આજે મારે ઉપવાસ છે—એ લાવનાને લઈ જાણી જોઈને હલકી પ્રવૃત્તિ કરતો જીવ અટકે છે, ધર્ત્યાહિ કારણે બાદ્ય ઉપવાસ ઉપયોગી છે. પરંતુ આ ઉપયોગીપણું જેની આંતર્દૃષ્ટિ ખૂલેલી હોય તેને જ વસ્તુતઃ કામ લાગે છે, જેને આત્માની પાસે રહેવાની પૂર્ણ ઈચ્છા છે તેને ઉપયોગી છે, પણ તે સિવાયનાને તો આ મળેલો વખત પણ સૂત્રાર્થ, પોરસિ, ધ્યાન આદિથી સુકૃત વિકથા-અમાહાહિમાં નિષ્ઠળ જાય છે.

સમ્યગ્નદૃષ્ટિવાળા જીવો આ ઉપવાસ કરી શકે છે. એકાદ દ્વિવસને માટે પણ આવી પ્રવૃત્તિ કરવાથી ધીમે ધીમે તેના માર્ગમાં આગળ વધી શકાય છે.

આ બાદ્ય ઉપવાસનો નિષેષ કરવાનો અહીં જરા પણ ઉદેશ નથી. ઉદેશ માત્ર સમ્યગ્નદૃષ્ટિ તરફ હોરવવાનો છે. સમ્યગ્નદૃષ્ટિ સાથે આ બાદ્ય ઉપવાસ થયા વિના કેવળ અજ્ઞાનહશાથી ડેહને ક્ષીણું કરી નખાય ત્યાં સુધી કરાતા ઉપવાસો એ ચોણ્ય નથી તે કહેવાનો છે અને કેવળ આ ઉપવાસનો આગ્રહ કરી આંતર્દૃષ્ટિને ભૂલી જવામાં આવે છે તેને જગૃત કરવાનો છે.

સમ્યક્, જ્ઞાન, સંવેગ વિગેરે ક્ષાયોપશમિક ગુણો જ્યાં અનુભવાય છે, ત્યાં આત્મશાન્તિ પણ અનુભવાય છે. એ પ્રમાણે સમ્યક્ તપશ્ચયો સેવનારને શાંતિનો અનુભવ થાય છે, માટે તપ એ પણ ક્ષાયોપશમિક લાવરૂપ છે. નંદન ભણ્યાર પણ ઉપવાસ કરીને છોડો હતો, પણ મિથ્યાદૃષ્ટિ હેવાથી આ ઉપવાસનું રહસ્ય તેના જાણુવામાં ન હતું.

તેનામાં આત્મશાંતિ ન હતી, તેમજ પૌરોગલિક આશાંસા તરફ ઢેણેલો હોઈ મિથ્યાત્વ તરફ તેનું સ્થાન હતું અને તેથી તેનું બાધ્ય તપ પણ વખાણુવા ચોગ્ય ન હતું. પૂરો સમજલયેદો એધ મિથ્યાહસિઓના વિશેષ પરિચયથી તેનાથી ભૂલાઈ ગયો હતો. એધસંશાશે પોતે અમુક ક્રમ્મ પાળનાર છે, એટલે ‘મારે આમ કરવું જાહીએ’-એ કારણે તેની એ પ્રવૃત્તિ હતી.

આત્મસ્વરૂપના માર્ગમાં ચાલનાર મહાન સહદ્યગુરુઓના અભાવે લુંબોને ખરો રસ્તો હાથ લાગતો નથી અને હૃદયની જાંડી લાગણીવાળી પ્રવૃત્તિ વિના તે સત્ય તર્ફે આ હૃદયમાં પ્રગટ થતા નથી.

સમ્યગ્રૂહિ થયા સિવાયની કિયા બંધનની હેતુભૂત થાય છે. વ્યક્ત કે અંયક્ત કોઈ પણ આશા કે દ્રિચ્છાથી તે કિયા કરાય છે. વિપરીત પ્રસંગો આવી પડતાં-હુઃઅહાયી પ્રસંગો આવી માગતાં સમભાવ રહી શકતો નથી અને આર્ત-શૈર્દ્ર પરિણામ થઈ આવે છે. આ સ્થળે સમ્યગ્રૂહિ તેનો સઘણો અર્થ લે છે, વિચારદ્વારા વિષયને પણ સમર્પે પરિણમાવે છે, હુઃઅમાંથી પણ સુખ શોધી કાઢે છે અને પૂર્વકર્મને ઉદ્ય જાણી આકુળતારહિત ઉદ્યને વેઠે છે. નંદન મણિયારમાંથી સમ્યગ્રૂહિ રીસાઈ ગયેલી હોવાથી અને મિથ્યાહસિ ત્યાં હાજર હોવાથી વિકટતાના પ્રસંગે તેને ચોતાનું આત્મભાન ભૂલાયું.

અનાવ એવો અન્યો કે-ઉનાળાનો વખત હોવાથી રાત્રિના વખતે તેને ખૂબ તૃપ્તા લાગી. તેને લઈને વિવિધ

પ્રકારના વિચારો જીઠવા લાગ્યા. આત્મભાન તો હતું એછું અને તેમાં તૃષ્ણાને લઈ આર્તિધ્યાન વૃદ્ધિ પામ્યું. તે વિચાર કરવા લાગ્યો. કે—‘ધન્ય છે તેઓને, કે જેઓ કુવા, વાવ, તળાવો બંધાવે છે. ધર્મોપદેશકોએ પણ આને ઉત્તમ ધર્મ ગણ્યો છે. જેઓ આને ધર્મ ગણ્યતા નથી પણ તેમાં હોષ બતાવે છે તેઓનું કહેલું મિથ્યા છે. ઉનાળામાં તૃષ્ણાતુર થયેલા અનેક પ્રાણીઓ પાણી પીને શાંતિ પામે છે. હું એક સુંદર વાવ હુદેથી બંધાવીશ. મને પણ પુન્નયબંધ થશે વિગેર.’

પોતાના માથે સંકટ કે વિષિતી આવી પડવા પહેલાં થીજાનાં હુઃઝો હૂર કરવા માટે જેઓ ડેઇ પણ જતના બહલાની આશા રાગ્યા વગર પોતાની સ્થિતિ અને અધિકારના પ્રમાણમાં પરોપકારના કાર્યમાં પ્રયત્નશીલ થાય છે, તેઓ ઉત્તમ ગણ્યાય છે; છતાં પોતાને તેવી સ્થિતિનો અતુલવ થયા પછી પણ જેઓ થીજાનાં હુઃઝોને કે હાજરોને જાણુતાં થાય છે અને તેઓને મહદ્દ આપવા પ્રયત્ન કરે છે, તે પણ ઠીક ગણ્યાય છે.

નંદન મણિયારની અત્યારની પાણી વિનાની હુઃઝી સ્થિતિએ, પોતાની માઝેક થીધ્મત્તુમાં અનેક જુવો પાણી વિના પ્રાણુત્યાગ કરે છે, હુઃઝી થાય છે, પીડાય છે, માટે તેને મારે મહદ્દ કરવી જેઠાં, એ સ્થિતિનું લાન કરાવી આપ્યું. તેની અત્યારની સ્થિતિને માટે તે વિચારો ચોણ્ય હતા, પણ પોતે ઉપવાસ કરી, પૌષ્ય થહેણું કરી, આત્માની નળુકમાં રહેવાનો. તથા આત્મગુણુને પોષણ મળે તેવી આવરણ વિનાની સ્થિતિમાં આગળ વધવાનો પ્રયત્ન કરવા નિમિત્તે એઠો હતો.

નિર્ણય કર્યો હતો—પ્રત્યાજ્યાન અહંક કર્યું હતું અથવા તેવા સામર્થ્ય વિના પણ તેવા સામર્થ્યને સ્ફુર્યતો હોય તેવા દેખાવવાળો જે પ્રયત્ન કરાતો હતો, તેને લાયકના—તે વાતને મહદ કરનાર અત્યારના તેના વિચારો ન હતા. એટલે કે—  
તૃપ્તાના અંગે આર્ત્યાનના પરિણામ તેમજ વાવ વિગેરે ભાંધવાના વિચારો આ સ્થિતિમાં તેને ચોણ્ય ન હતા.

વિશેષમાં આ વિચારોમાં તેને બદ્લાની પણ આશા હતી. ‘હું વાવ બંધાવી અન્યને પાણી આપું તેના બદ્લામાં પુન્ય બંધાય. તે પુન્યના કારણથી હું આગળ ઉપર સુખી થાડું.’ કાર્ય કરી બદ્લો માગવા જેવું આ કામ હતું. આ વ્યાપાર લેવડેવડના જેવો હતો. આમાં હનિયાના સુખની આશા હતી, પુન્યની ધર્છા હતી અને વાવ બંધાવવાનું અભિમાન હતું. આ આશયને લઈને તે કાર્ય આવરણ તોડનાર ન હતું પણ પુન્યનું પણ આવરણ લાવનાર હતું.

વાવ, કુવા, તળાવો બનાવવાથી જેમ અનેક જીવો પાણી પીને શાંત થાય છે—સુખી થાય છે, તેમ માછલાં અને નાના અનેક જંતુઓને નાશ પણ થાય છે. અગલાં આહિ પ્રાણીઓ તથા પારધિ, માધીમાર આહિ મનુષ્યો તરફથી તેમાં રહેલા જીવોને ઉપદ્રવ પણ થાય છે. એટલે જેમ તે કામ અનેક જીવોને સુખી કરનાર છે, તેમ હુઃખી કરનાર પણ છે. જે પુન્યનું અભિમાન છે, પુન્ય લેવાની ધર્છા છે, તો પાપ પણ આવવાનું જ. આ કારણને લઈને તે કિયા તદ્દન નિર્દોષ નથી, છતાં તે તે ભૂમિકામાં રહેલા જીવોને કરવા લાયકતું તે કાર્ય છે.

જ્ઞાની મહાત્માઓનું કહેલું એમ છે કે-તમે પરોપકારના કાર્ય લેવે કરો, પણ તેમાં આસક્તિ રાખ્યા વિના કરો, તેના બહલા તરીકે દ્રુગની આશા રાખ્યા વિના નિષ્કામવૃત્તિએ કરો અને લોડો તમોને 'સારા કહેશો' એવી ઈચ્છા વિના કરો. મતલભ કે-કોઈ પણ જલતના માન, મહાત્મ કે બહલાની આશા વિના જે કાર્ય કરો, તો તે કાર્યોમાંથી તમને બંધન કરેનારા થીજ નાશ પામશે, તમે તમારી ઝરજ બળવી ગણુશો; પણ જે કોઈ આશા કે ઈચ્છા રાખીને અલિમાનથી કે અજાનદશાથી હોરવાઈને કાર્યની શરૂઆત કરશો, તો તમે જરૂર બંધાવાના જ. પછી શુલ્ક કામ હશે તો પુન્યથી બંધાવાના, અશુલ્ક કામ હશે તો પાપથી બંધાવાના અને શુલ્કાશુલ્ક હશે તો પુન્ય-પાપ બંનેથી બંધાવાના; એ વાતમાં તમારે જરા પણ સંશય ન રાખવો.

નંદન મણિયારે પ્રાતઃકાળે ઉપવાસનું પારણું કર્યું. ત્યાર પછી પોતાના સંકલ્પાનુસાર તે નગરીના શ્રેણીક મહારાજા આગળ જઈ લેટણું મૂકી એક મોટી વાવ બંધાવવા માટે જમીનની માગણી કરી. રાજુએ તેની ઈચ્છાનુસાર વૈભારગિરિ પહોંનાં નીચાણુના પ્રહેશમાં જમીન આપી. નંદન મણિયારે તે સ્થળે એક મહાન સુંહર વાવ બંધાવી. તેની ચારે આઙ્લ અનેક વૃક્ષોવાળા ચાર બળીયા બનાવ્યા, એક અન્નક્ષેત્ર ઓદ્યું, તેમજ એક ધર્મશાળા અને હેવકુળ બંધાવ્યા.

આ વાવમાંથી અનેક મનુષ્યો પાણી ભરતા, ત્યાં સ્નાન કરતા અને વસ્તો ધોતા. ત્યાં વટેમાર્ગુંઓ વિશ્રાતિ લેતા અને ગરીબ લિક્ષુકો આહિ આશ્રય પણ લેતા.

નંદન મણિયાર અવારનવાર ત્યાં આવતો અને લોકોના સુખથી આ વાવ આહિ અંધાવનારની પ્રશંસા સાંલળી ઝૂશી થતો. હતો. સમ્યગુદૃષ્ટિ થયા સિવાય અંદે નિઃસ્પૃહપણું આવતું નથી, કરેલ કાર્યનો બદલો ભેળવવાની છિંછા શાંત થતી નથી અને નિંદા, સ્તુતિ, એહ કે હર્ષ થયા સિવાય રહેતો નથી. લોકોના સુખથી કરાતી પોતાની પ્રશંસાથી તે ઝૂશી થતો. કેચ લિક્ષુકોને પોતાની છિંછાનુસાર ત્યાંથી હાન મળતું ન હતું તેથી તેઓ નિંદા કરતા હતા, જે સાંલળી તે એહ પણ પામતો હતો.

અહીં આવનાર આત્મહઃષિ વિનાના અનેક મનુષ્યોનો તેને સંગ થતો હતો. મહાત્મા-આત્મજ્ઞાની પુરુષ તો કોઈક લાગ્યે જ આવતા હતા અને આવતા હતા તો પણ તેમને એળાખવાની કે તેમની સેવા કરવાની અથવા તેમની પાસેથી ધર્મશ્રવણ કરવાની, વાવ, બળીચા આહિના વ્યવસાયમાં શુંચવાચેલો હોવાથી તેને છિંછા પણ થતી ન હતી, વખત પણ મળતો ન હતો. ઘણું લાંબા વખતના આ કુસંગતું પરિણામ એ આંધું કે-તેની સમ્યગુદૃષ્ટિ સર્વથા નાશ પામી અને મિથ્યાહઃષિ, આત્મપ્રશંસા, વિષયોમાં આસક્તિ, કર્ત્વંધતું મિથ્યાલિમાન અને છિંદાનિષ્ઠથી હર્ષ-એહ ઇત્યાહિ વૃદ્ધિ પામ્યાં. આવી સ્થિતિમાં પૂર્વકર્મના પ્રથળ ઉહ્યથી તેના શરીરમાં વિવિધ પ્રકારના મોટા સોળ રોગો ઉત્પત્ત થયા. આ બાધ્ય રોગ અને મિથ્યાત્વરૂપ આંતરૂરોગ એમ ઉલય રોગથી તેના આર્તધ્યાનમાં વધારે થયો.

આ બનાવેલી સુંદર વાવ ઉપર તેને વિશેષ આસક્તિ

હતી. અહા ! આ સુંદર વાવ, આ બળીયાએ, આ હેવકુળ અને ધર્મશાળા, આ સુંદર હવેલી, આ ધન, માલ, મિલકત બધું મૂડીને શું મારે જલું પડ્યો ? હે વૈધો ! આ રોગનો પ્રતિકાર કરી મને બચાવો. તમે મારો તેટલું ધન આપું, પણ ડોણું બચાવે ? તૂઠીની બુટી કયાં છે ? મિથ્યાદિને લઈને જ આ અસતું મિથ્યા પહાથી પર આસક્તિ થાય છે. સમ્યાદિષ્ટ વિચારકારા જાગૃત હોય છે. આત્મા સિવાય સર્વ વસ્તુએ. તેણે અન્ય-મિથ્યા-ત્યાગ કરવા ચોઝ્ય માનેલી હોય છે. સમ્યગ્યાદિષ્ટ થતાં જ સર્વ વસ્તુએ ઉપરથી તેણે મોહ-મમત્વ કાઢી નાખ્યો. હોય છે. વિદ્ધાનો ત્યાગ કરવો તે જેટલો સહેલો અને ઈષ્ટ છે, તેટલો જ આ હુનિયાના સર્વ પહાથીનો ત્યાગ સમ્યગ્યાદિષ્ટને સહેલો હોય છે. અહોનિશ આત્મા એ જ તેનું લક્ષભિન્ન હોય છે. મોહ, મમત્વ, અજ્ઞાન, અલિમાન, રાગ, દ્રેષ્ટિયાદિ શત્રુએનો તેણે પહેલેથી જ પરાજ્ય કરેલો હોય છે, જેથી આ છેવટની સ્થિતિમાં તેને કોઈ નહતું નથી. તે સર્વ જીવાને આત્મ-સ્વરૂપ માને છે, એટલે મિથ્યાત્વની વૃદ્ધિ કરનાર નિમિત્તો પોતાના આત્મભળ આગળ એક પણ ટકી શકતા નથી. વળી જેને નિરંતર સાધુપુરુષોનો સંગ હોય છે, તેની આત્મ-જાગૃતિ નિરંતર વૃદ્ધિ પામતી જાય છે. આ નંદન મણિયારને તેવી ઉત્તમ સંગતિ ન હતી કે-આ છેવટની સ્થિતિમાં પણ કોઈ તેને જાગૃતિ આપે. વાત ખરી છે કે-જે મનુષ્ય પહેલાંથી જાગૃત થયો નથી, તે આવી છેવટની પ્રયાણ વખતની વળવળતી સ્થિતિમાં જાગૃત થઈ શકતો નથી.

નંદન મણિચાર આ ડેહનો ત્યાગ કરી, તે વાવ ઉપરની આસક્તિને લીધે આર્તધ્યાને મરણ પામી તે વાવમાં હેડકાપણે ઉત્પન્ન થયે.

મરણ વખતની જેવી યુદ્ધિ હોય-જેવી લાગણી હોય, તે પ્રમાણે ગતિ થાય છે. આ છેવટની મતિ પણ જુંદ્ગાના કર્તાવ્ય અને લાગણીએ ઉપર આધાર રાખે છે. પુદ્ગલ ઉપરના મોહ-મમત્વને લઈ તેમાં મમતા રહી જતાં, તે તે સ્થાને ઉત્પન્ન થલું પડે છે. નિધાન ઉપરના મમત્વને લઈ કેટલીક વાર તે નિધાનના રક્ષક તરીકે સાપ કે ઊંદર આહિપણે આ જીવ ઉત્પન્ન થાય છે. જ્ઞાનીપુરુષો આ છેવટની સ્થિતિ માટે ઘણી લલામણુ કરે છે. તેવા પ્રસંગે મોહ ઉત્પન્ન કરનારા નિમિત્તોને દૂર રાખવા અને મોહ-મમત્વને એછો કરાવનાર આત્મજ્ઞાની મહાત્માએને પાસે રાખવા, સમ્યગુદૃષ્ટિ જીવ ચોતે જગૃત હોય એટલે તેને બીજી મહાત્માએની મહદ્દી જરૂર નથી પડતી, છતાં કાંઈક મંદ જગૃતિ હોય તો અવક્ષ્ય આત્મજ્ઞાની પુરુષોને છેવટની સ્થિતિમાં પાસે રાખવા. સ્વાભાવિક પણ તેવા પુરુષો પાસે હોય તો અલૌકિક જગૃતિ રહ્યા કરે છે. આત્મજ્ઞાની પુરુષો પણ માયા કે પુદ્ગલોનો, મોહ કે મમત્વનો જરા પણ જરોંસા રાખી તેને વિશ્વાસે રહેતા નથી. આ દેખાવો સહજ વારમાં આત્મજ્ઞાન ભૂલાવી હો છે, તો પછી જુંદ્ગાના મોહો લાગ તે દૃશ્ય વસ્તુના ઉપકોગમાં ગયો. હોય છે તેવા પ્રમાદી જીવો કોઈ પણ ઉત્તમ આદંખન વગર છેવટની સ્થિતિમાં જગૃત રહે તે બનલું અશક્ય છે.

નંદન ભણિયાર વાવમાં ગલ્સ ૧૨ હેડકાપણે ઉત્પન્ન થયા  
પછી પોતાના નિત્યના પરિચયવાળી અને વિશેષ આસક્તિ-  
વાળી વસ્તુદ્વારા વાવને જેતાં, તર્કવિતર્ક-ઉહાપોહ કરતાં-  
વિચારણા કરતાં, આવું મેં કોઈ વખતે જેણું છે, તે સંબંધી  
ધારણા કરતાં, તેને પાછલા જન્મનું જ્ઞાન થવાદ્વારા ‘ભતિ-  
સમરણુ’ જ્ઞાન થયું.

ધણું પરિચયવાળી અને થોડા વખતના આંતરાવાળી  
વસ્તુની સમૃતિ જલ્દી થવા સંભવ છે. જેમ કોઈ ભૂલાગેલી  
વસ્તુ આપણને સંભરી આવે છે, તેમ આ નંદન ભણિયાર-  
ના જીવ દુર્દર્દ-હેડકાને પોતાની વાવ હેઠી પાછલી સર્વ વાત  
યાહ આવી. પોતાની આ ગતિ થવાથી તેને ધણું પદ્ધતાપ  
થયો, તેનું મૂળ કારણ શોધતાં વાવ આહિ ૧૩ પદ્ધારોં  
ઉપરની આસક્તિ સમજાઈ તથા આસક્તિનું કારણ શોધતાં  
અસતહિંબાળા જીવોનો પરિચય અને સહૃદહિંબાળા જીવોના  
સંબંધનો અભાવ સમજાયો—ભૂલ સમજાણ્ણી. પોતાના પૂર્વ-  
ધર્માચાર્યો યાહ આવ્યા. તેઓના સહૃદવચનોથી વિમુખ થવાનું  
કરું મળ્યું. હવે પાશ્વાત્તાપ કરવો નકામો છે. પોતાની ભૂલ  
સમજાણ્ણી, તે પણ ઓછા આનંદની વાત નથી. ધણું મનુ-  
ષ્યોને પોતાની ભૂલ સમજાતી નથી અને ઉહાચ સમજે તો  
સુધારતા નથી. હવે તો જગ્યા ત્યાંથી સવાર ગળ્ણીને પોતાનો  
માર્ગ શરૂ કરવો તે તેને ચોણ્ય લાગ્યો. તેણે પૂર્વે સાંભ-  
ગેલ અને તે પ્રમાણે વર્તન કરેલ પ્રત-નિયમો મનથી શહુણુ  
કર્યા, પોતાના સહૃદગુરુ તરીકે વીર પરમાત્માને હૃદ્યમાં  
ધારણુ કર્યા, કોઈ પણ સજીવ હેઠનો આહાર ન કરવાનો

નિયમ લીધો, નિર્ણોષ મેલ આહિ આઈ આજુવિકા કરવી અને શ્રી વીર પ્રભુનું અહોનિશ સમરણુ કરી આ જીવન પૂર્ણ કરલું-એવો નિશ્ચય કર્યો.

ખરી વાત છે કે-થોડા વખતના પણ આત્મજાની મહાત્મા પુરુષોના સંગનો બહલો મંદ્યા વગર રહેતો નથી. કર્યું કયાંઈ જતું નથી. સમ્યગ્દાટિ તો સમ્યગ્દાટિ, થોડા પણ પ્રકાશ, થોડું પણ આવરણનું ઓછું થબું, તે આ જીવને વિષમ પ્રસંગોમાં પણ જાગૃત કર્યો વગર રહેતું નથી; તો જેને અહોનિશ સતપુરુષોનો સંગ અને સમ્યગ્દાટિવાળી જાગૃતિ હોય છે, તેઓના આનંદનું, સુખનું અને સ્વરૂપસ્થિતિના ભાન વિષેનું પૂછલું જ શું ? તે તો અહોનિશ આનંદમાં જ રાચતા હોય છે.

શ્રી મહાબીર પ્રભુ કહે છે કે—“ ગૌતમ ! હમણાં હું અહીં આવીને રહેલો છું, તે વાતની અખર તે વાવમાં પાણી ભરવા અને સ્નાન કરવા ગયેલા લોકોની વાતો ઉપરથી તેણે સાંસ્કૃતિક, જેથી તેના આનંદનો પાર ન રહ્યો. ‘મારો ધર્મ-શુરુ ! મારો તારક નાથ ! અહીં આવેલ છે, જરૂર હું ત્યાં જઉ, તેના દર્શન કરું અને મારું જીવન સુધારું.’ આ લાગણીથી તે વાવમાંથી બહાર નીકલ્યો. રસ્તામાં મને વંહન નિમિત્તે આવતા શ્રેષ્ઠિક રાજના વોડાના પગ નીચે દ્વારાઈને તે ઢેડકો મરણ પાડ્યો. તેની ઈચ્છા-તેની આશા-તેના મનો-રથો મનમાં રહી ગયા. તેણે પોતાના મનનો એક તાર મારા ઢેહ ઉપર નહીં પણ મારા આત્મા ઉપર બાંધ્યો હતો, તે જ તેનું લક્ષ્યબિન્હ સાધ્ય હતું અને તે મારા ધ્યાનમાં

એકરસ થઈ ગયો હતો. ‘કૃપાળુ પ્રભુ પાસે જઉં અને મારા ધર્મશુરુનાં દર્શન કરી પાવન થઉં.’-આ લાગણીમાં ભરણું પામી તે હુદ્દર (હેડકો) સૌધર્મ હેવલોકમાં મહાર્ધિક વૈમાનિક હેવપણે ઉત્પન્ન થયેલા. ઉત્પન્ન થયા પછી તરત જ તેણે વિચાર કર્યો કે-હું અહીં કયા સુકૃતથી ઉત્પન્ન થયો છું ? કયા સારા કર્તાંયથી આ હેવની ઋદ્ધિ મને મળી છે ? અવધિશાનથી તપાસતાં તેને પોતાને સર્વ વૃત્તાંત સમજાયો. સર્વ ડામ પડતાં મૂડી દર્શનની લીલ લાગણીથી તે અહીં આવ્યો અને વિવિધ પ્રકારના નાટક-હેખાવ હેખાડવાડ્ય લક્ષ્ણ કરી, વંહન-નમન કરી, તે હેવ પોતાના સ્થાનકે ગયો.

“ગૌતમ ! આ હુદ્દરાંક હેવના જીવન ઉપરથી આ સલાના લોકોને ધાણું સમજવાનું અને જાણવાનું મળે તેમ છે. કુસંગતિનું પરિણામ અને સુસંગતિના ઇણો ગ્રત્યક્ષ રીતે આ હેવે અનુભવ્યાં છે. આ જીવને પોતાની અનેક લુંધારીઓમાં આવા અનેક અનુભવો થયા હોય છે કે થાય છે, તથાપિ જેઓ પોતાની ભૂલો સમજને તેમાં સુધારો કરે છે, નિરંતર સત્સંગતિમાં રહે છે અને આત્મહષિ જગૃત કરી તેનો છેવટ સુધીનો અનુભવ મેળેવે છે, તેઓ આ વિષમ સંસાર-સાગર તરી જાય છે અને જન્મ-ભરણનો ગ્રવાહ અંધ કરી આત્મશાનિતમાં સ્થિર થાય છે.”

